

12 ઓક્ટોબર 2018

બ્રમ્પટન પોતાનું ટ્રિપલ 'એ' ક્રેડિટ રેટિંગ અને 'સ્થિર' ભવિષ્યનું મૂલ્યાંકન જાળવી રાખવામાં સફળ

બ્રમ્પટન, ઓન્ટારિયો – આજે સ્ટેન્ડર્ડ એન્ડ પૂઅર (S&P) એ સીટી ઓફ બ્રમ્પટનના ટ્રિપલ એ' રેટિંગને આજે સમર્થન આપ્યું હતું. ટ્રિપલ 'એ' ક્રેડિટ રેટિંગની સાથે S&P દ્વારા સીટી ઓફ બ્રમ્પટન માટે 'સ્થિર' ભાવિ હોવાનું મૂલ્યાંકન પણ જારી કરવામાં આવ્યું. ટ્રિપલ 'એ' રેટિંગ કોઈ પણ નગરપાલિકાને પ્રાપ્ત થઈ શકે એવું ઉચ્ચતમ ક્રેડિટ રેટિંગ ગણવામાં આવે છે અને સ્ટેન્ડર્ડ એન્ડ પૂઅર (S&P)નાં મતે આવું રેટિંગ સીટીના ઉચ્ચ કોટીના નાણાકીય વ્યવસ્થાપનનું પ્રતિબિંબ છે.

મુખ્ય મુદ્દાઓ

S&Pનાં મતે આવું રેટિંગ ઘણા બધાં મુદ્દાઓને કારણે છે જેમાં નીચેના મુદ્દાઓ સામેલ છે:

- નાણાકીય વ્યવસ્થાપનની મજબૂત પ્રણાલિઓ: નિયંત્રણ પ્રણાલિઓ અને પારદર્શક સરળ પદ્ધતિ ધરાવતી સ્પષ્ટતા પર એકધારું ધ્યાન કેન્દ્રિત કરવું.
- અસાધારણ પ્રવાહિતા: બ્રમ્પટનના મજબૂત પ્રચાલન સિલ્લકો ઉચ્ચ કોટીના રોકડ પ્રવાહ તરફ આંગળી ચીંધે છે; જે ઋણ સેવાની આવશ્યકતાઓ કરતા ઘણું વધારે છે અને અન્ય નગરપાલિકાઓ કરતા વધુ મજબૂત છે.
- મજબૂત અર્થતંત્ર બ્રમ્પટનને એક અતિ પ્રબળ અને સુવ્યવસ્થિત અર્થતંત્રના અને, અને યથાર્થ સામાજિક આર્થિક અને વસ્તી વિષયક વિશિષ્ટતાઓના લાભ મળે છે.

ક્વોટ:

"આવું પ્રબળ રેટિંગ સીટીની નગરપાલિકાના ચાલું રહેલા સુશાસન અને નિવાસીઓ તરફની જવાબદારી પર મુકાતા એકધારા ભારને પ્રતિબિંબિત કરે છે. બ્રમ્પટન આપણા ડાઉનટાઉનને પરિવર્તિત કરવા માટેના જરૂરી રોકાણો કરીને આગળ ધપાવવા માટે બિલકુલ તૈયાર છે અને તે ઉપરાંત 2040 વિઝનમાં વર્ણવેલ જોડાયેલ, સમાવેશીત, નાવિન્ય ધરાવતા અને સાહસિક એવા બ્રમ્પટનની રચના કરવા માટે તૈયાર છે.

- *બ્રમ્પટન મેયર લિન્ડા જેફી*

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગોરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://www.facebook.com/brampton) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

मिडिया संपर्क :

नाटावी स्टोगडिल (Natalie Stogdill)

मिडिया संकलनकर्ता

सीटी ओफ् ब्राम्पटन

905.874.3654 | natalie.stogdill@brampton.ca